

આંક	:—	૩૫
દા ખ લ તા રીખ	:—	૨૨/૦૯/૨૦૨૨
૨જી. લીધા તારીખ	:—	૨૨/૦૯/૨૦૨૨
નિ કા લ તા રીખ	:—	૨૫/૦૩/૨૦૨૫
સમય	:—	૫. મા. દિ
		૦૨-૦૬-૦૫

નલીયાના બીજા અધિક સીવીલ જજ સાહેબની અદાલતમાં, મુ. : નલીયા-કચ્છ.

રેગ્યુલર દિવાની દાવા નં. ૧૧૨/૨૦૨૨

બરોડા ગુજરાત ગ્રામીણ બેંક

નલીયા શાખા, તા.અબડાસા

મારફતે મેનેજરશ્રી,

નરેન્દ્ર માણેકલાલ રાવલ

સરનામું:—બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, નલીયા-કચ્છ.

..... વાદી

વિરુદ્ધ

(૧) ઈબ્રાહીમછા તકીશા પીર

ઉ.વ. પુખ્ત, ધંધો ખેતી

(૨) મામદશા તકીશા પીર

ઉ.વ. પુખ્ત, ધંધો ખેતી,

રહે. બંન્ને રાઈ ફળીયો, નલીયા, તા.અબડાસા-કચ્છ.હ પ્રતિવાદી

દાવો :— લેણી રકમ અંગેનો દાવો

વાદી તરફે

વિધ્વાન વકીલ શ્રી એમ.એ.ખત્રી

પ્રતિવાદી તરફે

એકતરફી

—:: ઠરાવ ::—

(૧) વાદીના દાવાની ટુંકમાં હકીકત એવી છે કે, વાદી બેંક છે અને બેંકીંગ કાયદાની જોગવાઈ મુજબ કોન્સ્ટીટ્યુટેડ બોડી છે અને તેની હેડ ઓફિસ અમદાવાદ મધ્યે આવેલી છે. બેંક નાણાકીય ધિરાણ, લોન તથા ઓવર ડ્રાફ્ટની ફેસીલીટી આપે છે. આ કામના પ્રતિવાદીને

પશુપાલન લોન તા.૧૪/૦૩/૨૦૧૧ ના રોજ રૂ.૧,૬૫,૦૦/- લોન વાદી બેન્ક તરફથી લોન મંજૂર કરવામાં આવેલ. તે અંગે પ્રતિવાદીએ વાદી બેન્કની તરફેણમાં જરૂરી દસ્તાવેજો મોરગેજ કરી આપેલ છે. આમ લોન ભરપાઈ કરવાની જવાબદારી પ્રતિવાદીની રહે છે. પ્રતિવાદી લોનની રકમ નિયમીત માસિક હપ્તાથી ચુકવી આપવા ભરોસો આપેલ તેમ છતાં સદરહુ રકમ ચુકવવામાં નિષ્ફળ ગયેલ છે. આમ પ્રતિવાદી ઉપર તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી વ્યાજ સહિત રૂ.૮૫,૮૭૮.૦૦/- રકમ બાકી નીકળે છે જે ચુકવેલ નથી. આથી રકમ ચુકવવા વાદી બેન્કે લેખિતમાં વખતોવખત જાણ કરેલ છતાં નોટીસ આપવા છતાં કોઈ રકમ ચુકવેલ નથી કે કોઈ જવાબ આપેલ નથી. ત્યારબાદ વકીલશ્રી મારફતે નોટીસ કરવા છતાં પણ કોઈ રકમ જમા કરાવેલ નથી કે જવાબ આપેલ નથી. આથી દાવાનું કારણ ઉત્પન્ન થયેલ થયેલ છે. દાવો મુદતમાં છે. યોગ્ય કોર્ટ ફી રજુ રાખેલ છે. દાવો ચલાવવા નામદાર કોર્ટને હકુમત છે. આમ ઉપરોક્ત હકીકતોએ સદરહુ લેણી રકમ વ્યાજ સાથે પ્રતિવાદી ચુકવી આપે તેવો હુકમ ફરમાવવા તથા દાવા ખર્ચ તથા અન્ય રાહત દાદ અપાવવા અરજ કરેલ છે.

(૨) સદરહુ દાવો દાખલ થતાં દાવો રજીસ્ટરે લઈ, પ્રતિવાદીને ઘોરણસર સમન્સ કરવામાં આવેલ છે. જે બજી જતાં તેઓ તરફે તેઓના વિધવાન વકીલશ્રી હાજર થયેલ નથી કે કોઈ જવાબ દાવાજવાબ રજુ કરેલ નથી. આમ તેઓ તરફે જવાબ આપેલ ન હોઈ તેમજ કોઈ રજુઆત કરેલ ન હોઈ ત્યારબાદ તેઓ વિરુદ્ધ કામ એકતરફી ચલાવવાનો હુકમ આંક-૧ તળે કરવામાં આવેલ છે. પ્રતિવાદી તરફે કોઈ પુરાવો રજુ થયેલ નથી તેમજ વાદી તરફેના સાહેદની ઉલટતપાસ પણ કરેલ નથી.

(૩) સદરહુ દાવા કામે નીચે મુજબના મુદા મુકરર થયેલા છે.

-:: ISSUES ::-

1. Whether the Plaintiff Bank proves that Rs.95,978/- are due from the Defendant?
2. Whether the Plaintiff is entitled to get interest?if yes at what rate?
3. what order and Decree??

(૪) ઉપરોક્ત મુદાઓના નિર્ણય નીચે મુજબ છે.

૧. હકારમાં
૨. હકારમાં
૩. આખરી હુકમ મુજબ

(૫) વાદી તરફે પોતાની દાવાની હકીકતો પુરવાર કરવા માટે આ નીચે મુજબના મૌખિક તથા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલા છે.

ક્રમ	વિગત	આંક
૧	વાદી દર્શીતકુમાર સોલંકીનું પુરાવાનું સોગંદનામું	૧૩
૨	પાવરનામાની નકલ	૧૫
૩	ધીરાણ માટેની અરજી	૧૬
૪	સેક્સન લેટર	૧૭
૫	હાઈપોથીકેશન એગ્રીમેન્ટ ફોર એગ્રીકલ્ચર લોન્સ	૧૮
૬	લેટર ઓફ જનરલ લીયન	૧૯
૭	થર્ડ પાર્ટી વીટનેશ લેટર	૨૦
૮	લેટર ઓફ ગેરંટી	૨૧
૯	લેટર ઓફ જનરલ લીયન	૨૨
૧૦	કરજપત્ર	૨૩ થી ૨૫
૧૧	નલીયા ખાતા નં. ૫૮૩ ની નકલ	૨૬
૧૨	નલીયા સર્વે નં. ૧૦૫/૩ નો ૭/૧૨ નો ઉતારો	૨૭
૧૩	પ્રતિવાદીના ખાતાના સ્ટેટમેન્ટની નકલ	૨૮
૧૪	પ્રતિવાદીના ખાતાના સ્ટેટમેન્ટની નકલ	૨૯
૧૫	લીગલ નોટીસની ઓફીસ કોપી	૩૦
૧૬	પોસ્ટ ખાતાની રસીદો	૩૦,૩૧
૧૭	પોસ્ટ ખાતાની એકનોલોજમેન્ટ	૩૫

આ સિવાય વાદી તરફે વધુ કોઈ પુરાવો રજુ થયેલ નથી અને પુરાવો પુરો થયાનું જાહેર કરેલ છે.

(૬) ત્યારબાદ વાદીના વિધ્વાન વકીલશ્રીની દલીલો સાંભળી.

-:: નિર્ણય માટેના કારણો ::-

મુદા નં. ૧ તથા ૨ ની સંયુક્ત ચર્ચા :-

(૭) આ તમામ મુદાઓ એકબીજા સાથે સંકળાયેલા હોઈ પુનરાવર્તન નિવારવાના હેતુથી તેની એકસાથે ચર્ચા નીચે મુજબ કરેલ છે.

(૮) આ કામે વાદી બેંક તરફે દર્શાવેલ જી.સોલંકીનું પુરાવાનું સોગંદનામું આંક-૧૩ થી રજુ થયેલ છે. જેમાં અરજી મુજબની હકીકત જણાવેલ છે, જેથી પુનરાવર્તન કરેલ નથી. પ્રતિવાદી તરફે વાદી સાહેદની ઉલટતપાસ થયેલ નથી.

(૯) આ કામે રજુ થયેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લેવામાં આવે તો આ કામે વાદી બેંક તરફેના સાહેદે પ્રતિવાદીએ તેઓની બેંક પાસે લોનની માંગણી કરતાં વાદી બેંકે લોન વ્યાજ સાથે મંજૂર કરેલી અને તેમાં જામીન થયેલા અને તે અંગે તેઓએ જરૂરી એગ્રીમેન્ટ તથા કાગળો તૈયાર કરેલા. જે આ કામે રજુ રાખેલ છે

(૯/૧) પ્રતિવાદીએ લોનની અરજી કરેલ તથા હાયપોથીકેશન એગ્રીમેન્ટ, લેટર ઓફ એરેન્જમેન્ટ રજુ થયેલ છે જે આધારો જોતાં તેમાં પ્રતિવાદીની સહી છે અને પ્રતિવાદીને વાદી બેંક તરફથી સદરહુ લોન મંજૂર કરવામાં આવેલ છે.

(૯/૨) વધુમાં સદરહુ કામે સદરહુ લોન સંબંધે હપ્તા નક્કી કરવામાં આવેલ અને વ્યાજ દર પણ નક્કી થયેલ જેમાં પ્રતિવાદીએ સહી કરેલ છે. આમ પ્રતિવાદીએ સદરહુ એગ્રીમેન્ટ કરેલ હોવાનું અને વાદી બેંક પાસેથી સદરહુ લોનની રકમ લીધેલ હોવાનું જણાઈ આવે છે. આમ ઉપરોક્ત મૌખિક પુરાવા સાથે સદરહુ રજુ થયેલા દસ્તાવેજી પુરાવા ધ્યાને લેવામાં આવે તો પ્રતિવાદી એ વાદી બેંક પાસેથી સદરહુ લોન મેળવવાની અરજી કરતાં વાદી બેંકે લોન મંજૂર કરેલ હોવાનું જણાઈ આવે છે અને તે અંગે વાદી બેંકે જરૂરી કાગળો તૈયાર કરેલા છે જેમાં પ્રતિવાદીએ સહીઓ કરી આપેલ છે. સદરહુ હકીકતોનું પ્રતિવાદી તરફે કોઈ ખંડન થયેલ નથી કે કોઈ ખંડનાત્મક પુરાવો પણ રજુ થયેલ નથી.

(૧૦) પ્રતિવાદી સદરહુ લોનની રકમ નિયમીત ભરતા ન હોવાથી અને ચડત રકમ થઈ

જતાં વાદી બેંકે પ્રતિવાદીને નોટીસ કરેલ છે જે આ કામે રજુ થયેલ છે જે ધ્યાને લેતાં વાદી બેંકે સદરહુ પ્રતિવાદીને નોટીસ કરેલાનું જણાઈ આવે છે. જે આંક-૨૯ થી રજુ છે. આમ સમગ્ર પુરાવો ધ્યાને લેતાં આ કામના વાદી બેંક પાસેથી પ્રતિવાદીએ સદરહુ લોન મેળવેલ જે સંપૂર્ણ ભરપાઈ ન કરતાં રૂ.૯૫,૯૭૮.૦૦/- લેણી રકમ વ્યાજ સહિત નીકળે છે.

(૧૧) વાદી બેંકે સદરહુ રકમ પર વ્યાજની પણ માંગણી કરેલ છે. અને બેંકના નિયમ તથા કરાર મુજબ ચડત વ્યાજ સહિતની માંગણી કરેલ છે. પ્રતિવાદીએ વાદી બેંક પાસે ધિરાણ લીધેલ છે તે હકીકત છે અને તેની લેણી રકમ થયેલ છે તે સંજોગોમાં વાદીને યોગ્ય ટકાના દરે વ્યાજ અપાવવું જરૂરી છે. વિશેષમાં એ હકીકત પણ ધ્યાને લેવાની છે કે વાદી એ જાહેર હિતમાં કાર્ય કરતી બેંક છે, અને તેની રકમ જો આ રીતે વણચુકવાયેલ રકમની રીતે પડી રહે તો વાદી ઉપર ઘણો મોટો બોજો પડે તેમ છે. આ પ્રકારે વાદીને વ્યાજ મળી રહે તે પ્રજાકીય કામમાં અને પ્રજાને વધુ સારી સુવિધા પુરી પાડવા માટે થઈ શકે, તેમજ આ પ્રકારે પ્રતિવાદી ધ્વારા સમયસર ચુકવણી ન કરવાને કારણે વાદીને વ્યાજનું પણ નુકસાન થયેલ છે કે જે અન્ય જગ્યાએ આ રકમને ઈન્વેસ્ટ કરી તેના ઉપર આવક મેળવી શકેલ હોત. તે હકીકતને ધ્યાને રાખી જો વાદી બેંકને પ્રવર્તમાન સમયમાં ચાલતા રાષ્ટ્રીયકૃત બેંકોના દર મુજબ વાર્ષિક ૬ % ના સાદા વ્યાજ ના દરે આપવામાં આવે તો તે દરેક રીતે ન્યાયી ગણાશે. આથી વાદી બેંક સદરહુ મંજૂર કરેલ રકમ ઉપર વાર્ષિક ૬% વ્યાજના દર સાથે રકમ મેળવવા હકકદાર બને છે તેમ આ અદાલતનું માનવું છે

(૧૨) આમ ઉપરોક્ત કરેલ ચર્ચા ધ્યાને લેતા વાદી બેંકની લોનની લેણી ચડત રકમ રૂ.૯૫,૯૭૮.૦૦/-પ્રતિવાદી પાસે લેવાની બાકી રહે છે અને તે રકમ વાર્ષિક ૬ % ના સાદા વ્યાજના દરે મેળવવા હકકદાર થાય છે તેવું ઠરાવેલ છે અને તેવી હકીકતો વાદી પોતાના પુરાવાથી પુરવાર કરી શકેલ છે. જ્યારે પ્રતિવાદીએ પોતાના પુરાવાથી વાદી બેંક પાસેથી આવી કોઈ રકમ મેળવેલ નથી કે ખોટી રીતે તેની સહીઓ મેળવેલ છે અને તેઓ આવી કોઈ રકમ ચુકવવા જવાબદાર નથી તેવી કોઈ હકીકત પુરવાર કરી શકેલ નથી. આથી મુદા નં.૧ તથા ૨ નો જવાબ હકારમાં અને તે અન્વયે મુદા નં.૩ અંગે નીચે મુજબનો આખરી હુકમ ફરમાવવામાં આવે છે.

-:: આખરી હુકમ ::-

૧. વાદી બેંકનો દાવો આથી અંશતઃ મંજૂર કરવામાં આવે છે.
૨. આ કામના પ્રતિવાદીએ, વાદી બેંકને રૂ.૯૫,૯૭૮.૦૦/- (અંકે રૂપિયા પંચાણું હજાર નવસો અઠોતેર પુરા) દાવા તારીખથી વાર્ષિક ૬ % (છ ટકા) ના સાદા વ્યાજના દરે ચુકવી આપવાનો આથી હુકમ કરવામાં આવે છે.
૩. વાદી બેંકનું દાવાનું ખર્ચ પ્રતિવાદીએ ભોગવવું અને પ્રતિવાદીને થયેલ ખર્ચ પ્રતિવાદીએ જાતે ભોગવવો.
૪. હુકમ મુજબ હુકમનામું દોરવું.
હુકમ આજ રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી મારી સહી કરીને જાહેર કરવામાં આવ્યો.

તા. ૨૫/૦૩/૨૦૨૫
નલીયા-કચ્છ

(એન.વી.ગુપ્તા)
બીજા અધીક સિવિલ જજ
નલીયા-કચ્છ
GJ01650